



FIL/SE/2023-24/15
7th August, 2023

National Stock Exchange of India Limited
Listing Department
5th Floor, Exchange Plaza, C-1, Block-G,
Bandra-Kurla Complex, Bandra (E)
Mumbai-400 051
Security Symbol: **FILATEX**

BSE Limited
Listing Department
25th Floor, Pheroze Jeejeebhoy Towers
Dalal Street,
Mumbai - 400 001
Security Code: **526227**

Sub.: Publication of Unaudited Financial Results for the Quarter ended on 30th June, 2023 in Newspapers.

Dear Sir,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed newspaper cuttings of the advertisement regarding Unaudited Financial Results for the Quarter ended on 30th June 2023, approved by the Board in its Meeting held on 4th August 2023, in the following newspapers:

1. Mumbai Edition of "The Financial Express" on 05.08.2023 in English language
2. Surat Edition of "Gujarat Mitra" on 05.08.2023 in Gujarati language
3. All Edition of "Business Standard" on 07.08.2023 in English language

You are requested to take the same on your records.

Thanking You,

Yours Faithfully,
For FILATEX INDIA LIMITED

RAMAN KUMAR JHA
Company Secretary & Compliance Officer

CORPORATE OFFICE

Bhageria House
43 Community Centre
New Friends Colony
New Delhi - 110025, India
P +91.11.26312503,26848633/44
F +91.11.26849915
E filidelihi@filatex.com

REGD. OFFICE & WORKS

S. No. 274 Demni Road
Dadra - 396193
U.T. of Dadra & Nagar Haveli
India
P +91.260.2668343/8510
F +91.260.2668344
E filidadra@filatex.com

SURAT OFFICE

Bhageria House
Ring Road
Surat - 395002
India
P +91.261.4030000
F +91.261.2310796
E filisurat@filatex.com

MUMBAI OFFICE

321, Maker Chamber - V
Nariman Point
Mumbai - 400021
India
P +91.22.22026005/06
F +91.22.22026006
E filimumbai@filatex.com

Website: www.filatex.com

NITIN SPINNERS LIMITED				
Regd. Office : 16-17 Km. Stone, Chittor Road, Hamirgarh, Bhilwara - 311 025 (Rajasthan) CIN L17111RJ1992PLC006987 Tel. : + 91 1482 286110 ; Fax : 91 1482 286117. Website : www.nitinspinners.com E-Mail-ns[nitinspinners.com]				
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2023				
S. No.	Particulars	Quarter Ended		(Rs. in Lacs)
		30.06.2023	31.03.2023	Year Ended
		Un-audited	Audited	Un-audited
1	Total Income from Operations (Net)	61812.54	65615.96	241001.69
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	3896.20	4074.41	17587.50
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional items)	3896.20	4074.41	17587.50
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional items)	2889.86	3853.57	16481.05
5	Total Comprehensive Income/(Loss) for the period [(Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income/(Loss) (after tax)]	2891.68	4168.76	16714.91
6	Equity Share Capital (Face Value Rs. 10/- each)	5622.00	5622.00	5622.00
7	Reserves i.e. Other Equity	-	-	97268.11
8	Earning Per Share (Rs. Per Shares) (of Rs. 10/- each) (for continuing and discontinued operations)-			
	1. Basic	5.14	6.85	29.32
	2. Diluted	5.14	6.85	29.32
Note:- The above is an extract of the detailed Financial Results for the Quarter ended 30th June, 2023 filed with the Stock Exchanges under regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites www.bseindia.com, www.nseindia.com and Company's website www.nitinspinners.com. For and on behalf of Board of Directors For Nitin Spinners Ltd (Dinesh Nolkha) Managing Director DIN : 00054658 Date : 05-08-2023 Place : Hamirgarh, Bhilwara				

FILATEX INDIA LIMITED				
Regd. Office : S.No.274, Demni Road, Dadra-396 193 (UT of Dadra & Nagar Haveli) Corporate Identification Number (CIN)- L17119DN1990PLC000091				
Extract of Statement of Unaudited Financial Results for the Quarter ended June 30, 2023				
S. No.	PARTICULARS	Quarter Ended		(Rs. In Lakhs)
		30.06.2023	31.03.2023	Year Ended
		(Unaudited)	(Audited)	(Unaudited)
1	Total income from operations	1,06,927	1,04,678	4,30,387
2	Net Profit/ (loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	2,396	2,527	12,208
3	Net Profit/(Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	2,396	2,527	12,208
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	1,762	1,861	8,990
5	Total Comprehensive Income for the period [Comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	1,769	1,910	9,014
6	Paid up Equity Share Capital (Face value of Rs. 1/- each)	4,439	4,430	4,430
7	Earnings Per Share (Face value of Rs. 1/- each) (Not Annualised)			
	Basic :	0.40	0.42	2.02
	Diluted :	0.40	0.42	2.02
Notes: a) The above is an extract of the detailed format of results for Quarter ended June 30, 2023 filed with the stock exchanges under regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Yearly financial results are available on Company's Website www.filatex.com and on the website of the Stock Exchanges www.nseindia.com and www.bseindia.com. b) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on August 04, 2023 and have undergone "Limited Review" by the Statutory Auditor's of the Company. The financial results have been prepared in accordance with Indian Accounting Standards (IND-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and relevant amendment rules thereafter. On behalf of the Board of Directors Sd/- MADHU SUDHAN BHAGERIA CHAIRMAN & MANAGING DIRECTOR DIN : 00021934 Place : New Delhi Dated : August 04, 2023				

CAPRI GLOBAL CAPITAL LIMITED				
CIN - L65921MH1994PLC173469 Regd.Office : 502, Tower-A, Peninsula Business Park, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400013. E-mail:investor.relation@capriglobal.in, Website : www.capriiloans.in Tel No. - +91 22 40888100 Fax No. - +91 22 40888170				
EXTRACTS OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023				
S. No.	Particulars	Quarter ended		(Rs in millions)
		30.06.2023	30.06.2022	Year ended
		(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from operations (Net)	5,010.80	2,789.94	14,633.45
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	838.78	609.93	2,682.84
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	838.78	609.93	2,682.84
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	636.08	460.82	2,046.54
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other comprehensive Income (after tax)]	620.30	430.29	2,015.09
6	Equity Share Capital	412.31	351.49	412.31
7	Other equity			35,242.35
8	Earnings per share (not annualised for quarter)			
	Basic (Rs.)	3.09	2.62	11.06
	Diluted (Rs.)	3.05	2.59	10.94
EXTRACTS OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023 (Rs in millions)				
S. No.	Particulars	Quarter ended		Year ended
		30.06.2023	30.06.2022	31.03.2023
		(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from operations (Net)	3,924.81	2,171.73	11,439.72
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	574.03	466.48	1,898.85
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	574.03	466.48	1,898.85
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	429.48	345.93	1,415.37
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other comprehensive Income (after tax)]	417.79	326.63	1,395.69
6	Equity Share Capital	412.31	351.49	412.31
7	Other equity			33,292.81
8	Earnings per share (not annualised for quarter)			
	Basic (Rs.)	2.08	1.97	7.65
	Diluted (Rs.)	2.06	1.95	7.56
# - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules				
Notes: 1. The above consolidated and standalone financial results of the Company have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company at its meeting held on August 5, 2023. 2. The consolidated and standalone financial results of the Company for the quarter ended June 30, 2023 are in compliance with Indian Accounting Standards (Ind AS) as notified by the Ministry of Corporate Affairs and have been reviewed by the statutory auditors of the Company. 3. The above is an extract of the detailed format of Quarterly Results filed with BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Results are available on the websites of the stock exchanges i.e. www.bseindia.com and www.nseindia.com and Company's website www.capriiloans.in On behalf of the Board of Directors Sd/- Rajesh Sharma Managing Director & Chief Financial Officer (DIN - 00020037) Place: Delhi Date: August 5, 2023				

KERALA WATER AUTHORITY e-Tender Notice	
Tender No: 106/2023-24/KWA/PHC/D2/TVM/RT1 Kottukkal Grama Panchayath- Design and Construction of 6.00 LL capacity of OHSR, 2.5 LL Sump at Punnakulam EMD: Rs. 1,00,000/- Tender fee: Rs. 9,759/- Last Date for submitting Tender: 17.08.2023 03:00:pm Phone: 0471-2322303 Website: www.kwa.kerala.gov.in, www.etenders.kerala.gov.in Superintending Engineer PH Circle, Thiruvananthapuram	
KWA-JB-GL-6-962-2023-24	

THE ASKA COOPERATIVE SUGAR INDUSTRIES LTD.	
P.O. Nuagam (Aska) - 761111, Ganjam District, Odisha Ph.No.06822-273464, email:askasugar@yahoo.co.in Website:www.askasugar.com	
TENDER CALL NOTICE	
Letter No.MFG/DIST-2023-24/735 Dt.05.08.2023 The Aska Cooperative Sugar Industries Ltd., at Nuagam (Aska) in Ganjam District of Odisha State invites sealed tenders from experienced and reputed Manufacturers/Bidders having valid GSTIN and requisite experience of Installation Projects of Mass flow meters, Radar based level transmitters, Sensor based Electronics bottle Counters, PLC (Programmable Logic Controller) and other appliances/accessories in the State of Odisha with automation through e-Abkari to use in Distillery and Country Liquor bottling units for the year 2023-24. Please visit our website www.askasugar.com for details of the Tender Call Notice. The last date for submission of tender till 05:00P.M. on 25/08/2023 Secretary	

TELANGANA STATE POWER GENERATION CORPORATION LIMITED	
VIDYUT SOUDHA : HYDERABAD - 500 082	
T.No.e-11/CEG/SEG-III/E8A15/Conveyor Belts/TSGENCO/2023-24 BTPS - Manufacture and Supply of various sizes of FR Grade NYLON/NYLON Heavy Duty Conveyor Belts required for coal handling plant of BTPS, Manuguru, Bhadradi Kothagudem Dist. Value of the works: ₹.1,55,49,987/-, Scheduled Open & Closing Date: 21.07.2023 at 18:00 Hrs & 17.08.2023 at 11:30 Hrs.	
T.No.e-08/CE/Civil/Thermal/TSGENCO/2023-24 KTPP - Providing Painting to the structural steel supporting structures of Boiler, Bunkers (7 Nos) and ESP of Stage-I (1X500 MW), Kakatiya Thermal Power Project, Chelpur, Jayashankar Bhupalpalay Dist. Value of the works: ₹.75,61,400/-, Scheduled Open & Closing Date: 27.07.2023 at 17:00 Hrs & 17.08.2023 at 17:00 Hrs.	
T.No.e-70/CE/Q&M/KTPP/Civil/PHD/TSGENCO/2023-24 KTPP - Procurement of Paints for Kakatiya Thermal Power Project, Chelpur, Jayashankar Bhupalpalay Dist. Value of the works: ₹.20,83,000/-, Scheduled Open & Closing Date: 03.08.2023 at 11:00 Hrs & 21.08.2023 at 11:00 Hrs	
For further Details: "www.tsgenco.co.in, https://tender.telangana.gov.in, & https://auction.telangana.gov.in	

FORM G INVITATION FOR EXPRESSION OF INTEREST FOR GOPINATH DAIRY PRODUCTS PRIVATE LIMITED																				
Operatingin: Processing of Milk and Milk Products Location:Plot no D-14/2 MIDCTTC Industrial Area,Turbhe,Thane MH 400614 Under Regulation 36A (1) of the Insolvency and Bankruptcy (Insolvency) Resolution Process for Corporate Persons) Code, 2016																				
RELEVANT PARTICULARS																				
1.	Name of the corporate debtor	Gopinath Dairy Products Private Limited CIN: U24100PN2010PTC137441																		
2.	Address of the registered office	Plot no D-14/2 MIDCTTC Industrial Area, Turbhe,ThaneMH400614																		
3.	URL of website	https://www.gopinathdairy.com/																		
4.	Details of place where majority of fixed assets are located	At Registered Address: Plot no D-14/2 MIDCTTC Industrial Area, Turbhe,ThaneMH 400614																		
5.	Installed capacity of main products/ services	Installed Production Capacity: <table><tr><th>Sr. No.</th><th>Name of Product</th><th>Capacity perday</th></tr><tr><td>1</td><td>Milk</td><td>2 Lakh litres</td></tr><tr><td>2</td><td>Curd</td><td>5,000 Kgs</td></tr><tr><td>3</td><td>Butter Milk</td><td>25,000 litres</td></tr><tr><td>4</td><td>Ghee from Butter</td><td>3,000 Kgs</td></tr><tr><td>5</td><td>Panaser</td><td>3,000 Kgs</td></tr></table>	Sr. No.	Name of Product	Capacity perday	1	Milk	2 Lakh litres	2	Curd	5,000 Kgs	3	Butter Milk	25,000 litres	4	Ghee from Butter	3,000 Kgs	5	Panaser	3,000 Kgs
Sr. No.	Name of Product	Capacity perday																		
1	Milk	2 Lakh litres																		
2	Curd	5,000 Kgs																		
3	Butter Milk	25,000 litres																		
4	Ghee from Butter	3,000 Kgs																		
5	Panaser	3,000 Kgs																		
6.	Quantity and value of main products/ services sold in last financial year	Nil (The CD has ceased its business operations in 2018)																		
7.	No. of employees/ workmen	Nil.																		
8.	Further details including last available financial statements (with schedules) of two years, lists of creditors, relevant dates for subsequent events of the process are available at:	Details can be obtained by sending an email to: gopinathdairy.cirp@gmail.com																		
9.	Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at:	Eligibility Criteria for Prospective Resolution Applicant to submit the Resolution Plan: For Body Corporate/SoleInvestor: Net Worth: Minimum net worth of INR 10 Crores at the group level as per the latest available audited financial statements. Turnover: Minimum Turnover of INR 30 Crores at the group level as per the latest available audited financial statements For Consortium: Net Worth: Minimum net worth of INR 20 Crores at the group level as per the latest available audited Financial statements. Turnover: Minimum Turnover of INR 50 Crores at the group level as per the latest available audited financial statements. For Investment Companies/ Fls/ Fund houses/ PE Investors: Assets Under Management: Minimum Assets Under Management of INR 50 Crores at the group level as per the latest available audited financial statements. Committed Funds: Minimum Committed funds of INR 50 Crores. Further details are set out in the detailed invitation for Expression of Interest which canbe obtained by emailing to gopinathdairy.cirp@gmail.com																		
10.	Last date for receipt of expression of interest	August 21, 2023																		
11.	Date of issue of provisional list of prospective resolution applicants	On or before August 31, 2023																		
12.	Last date for submission of objections to provisional list	On or before September 5, 2023																		
13.	Process email id to submit EOI	gopinathdairy.cirp@gmail.com																		
Sd/- Brijendra Kumar Mishra Resolution Professional Registration No. :IBBI/IPA-002/IP-N00109/2017-2018/10257 Registered Address:Flat No.202.2"Floor,Bhoj Bhavan,PlotNo.18-D, Shivpuri, Sion-Trombay Road,Chembur (East),Mumbai,Maharashtra,400071 Date:August 7,2023 For Gopinath Dairy Products Private Limited Place:Mumbai																				

IG PETROCHEMICALS LIMITED				
CIN: L51496GA1988PLC000915 Regd. Office: T-10, 3 rd Floor, Jairam Complex, Mala, Neugi Nagar, Panaji, Goa - 403 001. Tel: 0832-2970973; Email: igpl@igpetro.com; Website: www.igpetro.com				
STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 TH JUNE, 2023				
(₹ in lakhs)				
Sr. No.	Particulars	Quarter Ended		Year Ended
		30-06-2023	30-06-2022	31-03-2023
		Unaudited		Audited
1	Total Income	56,265.53	66,437.55	2,37,455.66
2	EBITDA	6,656.33	12,422.81	33,994.54
3	Net profit before tax	4,819.75	10,869.00	26,861.94
4	Net profit after tax	3,566.40	8,130.90	20,032.73
5	Equity Share Capital (Face value of ₹ 10/- each)	3,079.81	3,079.81	3,079.81
6	Reserves			1,19,983.69
7	Basic & Diluted EPS in ₹ (Not Annualised)	11.58	26.40	65.05
For I G Petrochemicals Limited Sd/- Nikunj Dhanuka Managing Director & CEO DIN 00193499 Place : Mumbai Date : 4 th August, 2023				

MSTC LIMITED	
(A Govt. of India Enterprise) CIN: L27320WB1984GOI026211; GSTIN: 19AACMM0021E1Z4 Plot no CF-18/2, Street No. 175, Action Area-1C, New Town, Kolkata - 700156 W.B. Website: www.mstcindia.co.in; Email: cssect@mstcindia.in; Phone: 033-2340-0000	
NOTICE FOR CONVENING 58 TH ANNUAL GENERAL MEETING THROUGH VC/OAVM	
Members may please note that 58 th Annual General Meeting ("AGM") of the members of MSTC Limited ("Company") will be held on Wednesday, 20th September, 2023, at 11:00 A.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio Video Means ("OAVM") in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the Rules made there under and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular nos.14/2020, 17/2020, 20/2020, 02/2021, 02/2022 & 10/2022 issued by Ministry of Corporate Affairs (MCA) and Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 & SEBI/HO/CFD/PoD-2/CIR/2023/4 issued by the Securities & Exchange Board of India (SEBI), to transact the businesses set out in the Notice calling the AGM. In compliance with the above MCA & SEBI Circulars, electronic copies of the Notice of AGM and Annual Report for the financial year 2022-23 will be sent through email mode only to all those members whose email addresses are registered with the Company/Depository Participant(s). Members are requested to update their email address immediately to enable the company to send the copy of annual report and notice of AGM to the shareholders. The Notice of AGM and Annual Report will also be available on the Company's website at www.mstcindia.co.in and on the website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of NSDL at https://www.evoting.nsdl.com . Members can attend and participate in the AGM through the VC/OAVM facility only. The instructions for joining the AGM through VC/OAVM will be provided in the Notice of AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under section 103 of the Companies Act, 2013. Manner of registering/ updating email addresses : <ul style="list-style-type: none">Members holding share(s) in physical mode are requested to send duly filled up and signed Form ISR-1 mentioning e-mail id alongwith requisite enclosures,through email to MSTC Limited at cssect@mstcindia.in or to the RTA, Alankit Assignments Limited at virenders@alankit.com. Format of Form ISR-1 can be downloaded from the link https://www.mstcindia.co.in/cms/Investor/Investor-Service-Related-Form.pdf.Members holding share(s) in Demat/Electronic mode are requested to register/update their e-mail addresses with their respective Depository Participants for receiving all communications from the Company electronically. Manner of registering/ updating bank details for receiving dividends directly in bank accounts through NECS : <ul style="list-style-type: none">Members holding share(s) in physical mode are requested to send duly filled up and signed Form ISR-1 mentioning bank details alongwith requisite enclosures and duly filled and signed Form ISR-2, through email to MSTC Limited at cssect@mstcindia.in or to the RTA, Alankit Assignments Limited at virenders@alankit.com. Format of Form ISR-1 & Form ISR-2 can be downloaded from the link https://www.mstcindia.co.in/cms/Investor/Investor-Service-Related-Form.pdf.Members holding share(s) in Demat/Electronic mode are requested to register/ update their bank details with their respective Depository Participants. Manner of casting Vote through e-voting : <ul style="list-style-type: none">Shareholders will have an opportunity to cast their votes remotely on the businesses as set forth in the Notice of the AGM through remote e-voting system from Saturday, September 16, 2023 at 9:00 A.M. till Tuesday, September 19, 2023 at 5:00 P.M. The facility for e-voting will also be made available during the AGM. Detailed procedure for remote e-voting and e-voting during the time of AGM will be provided in the Notice of AGM.The login credentials for casting the votes through e-voting shall be made available to the members through e-mail after successfully registering their email addresses in the manner provided above. Manner of attending AGM through VC/OAVM : Facility to attend the AGM through VC/OAVM will be available through the NSDL e-Voting system at www.evoting.nsdl.com . Members are requested to carefully read the notes set out in the Notice of the AGM with respect to instructions for attending the AGM through VC/OAVM and for remote e-voting and e-voting at the AGM. This notice is being issued for the information and benefit of all the members of the Company in compliance with the applicable circulars of the MCA and SEBI. For MSTC Limited Sd/- Ajay Kumar Rai Company Secretary & Compliance Officer Date: 27.07.2023 Place: Kolkata	

TATA

TATA INVESTMENT CORPORATION LIMITED

Elphinstone Building, 10 Veer Nariman Road, Mumbai 400 001.
Tel 91 22 6665 8282 Fax 91 22 6665 7917
CIN: L67200MH1937PLC002622 e-mail tidl@tata.com website: www.tatainvestment.com

Statement of Unaudited Standalone and Consolidated Financial Results for the Quarter ended 30th June, 2023

(Rs. in crores)

Particulars	Standalone				Consolidated			
	Quarter ended		Year Ended		Quarter ended		Year Ended	
	Unaudited		Audited		Unaudited		Audited	
	30-06-2023	30-06-2022	31-03-2023	31-03-2023	30-06-2023	30-06-2022	31-03-2023	31-03-2023
1. Total Income	122.88	126.41	41.17	288.34	151.86	102.08	30.90	277.72
2. Net Profit for the period before Tax	114.17	115.31	35.55	258.55	151.76	97.28	24.39	272.28
3. Net Profit for the period after Tax	111.33	108.69	31.17	240.90	147.74	89.74	19.91	251.75
4. Total Comprehensive Income for the period [Comprising Profit after tax and Other Comprehensive Income (after tax)]	2,964.80	(2,150.00)	(175.27)	147.68	3,002.18	(2,168.92)	(187.02)	158.22
5. Equity Share Capital	50.60	50.60	50.60	50.60	50.60	50.60	50.60	50.60
6. Earnings Per Share (before and after extraordinary items) (of Rs.10/- each) Basic / Diluted (in Rs.)	22.00	21.48	6.16	47.61	29.02	17.78	4.01	49.78

Notes:

1.	As on		
	30-06-2023	30-06-2022	31-03-2023
	22,124.21	17,382.85	19,402.26
Total Equity (post tax) (Rs. in crores)	4,373.00	3,436.00	3,835.00

2. The above is an extract of the detailed format of quarter ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter ended Financial Results are available on the Stock Exchange websites at www.bseindia.com and www.nseindia.com and also on Company's website www.tatainvestment.com.

Tata Investment Corporation Limited

(Noel N. Tata)
Chairman
DIN 00024713

Mumbai, 4th August, 2023

કરો સદરજી બ્રમળ કોરી વસાણાથી અગર બીજી રોત અન્બન તબદલ કરવાની
ગેરવાઈએસ/અુનાઈલ પ્રવુટી કોરી રહેલ હોવાનું અમારા અસીબની બાધામાં આવેલ
છે અને તે અંગે અમારા અસીલ તેઓ વિરઘ્જ વજરૂં દિવાની/ફોબદારી રાઘે
કાથદેસરના કાચંદાબી કરનાર છે. જેથી સદરજી બ્રમળ બાળતે ઉપરોક્ત ઈસમ
સામે કોરેપણ ચલ્દિતએ કોરેપણ પ્રકારનાં ચલ્દહાર કે નાણાફિલ્લ લેવી-દેવી કરવી
નહી અને છતાં પણ જો કરવામાં આવશે તો તેમને કોરેપણ પ્રકારના કાથદેસરના
હકક, અદીકાર કે રાઈટલ પ્રાપ્ત થશે નહીં અને તકરાર સીયબી બીરૂં કંઈપણ
હોસંસ થશે નહીં અને નીચી અમારા અસીલને થતા તમામ ગંત્ર તથા ખર્ચ તથા
સંપુર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે જે અંગે લાગતા વળગતા તમામે નોંધ લેવી.

ઓફિસ:- બી-૩૧૦,
મિલિનાયમ પોર્ટબ્ઝ,
નાણામી કિડની હોસ્પિટલ સામે,
લાલ દરવાજા, સુરત.

અમો મારફતે
નિલેશ એમ. વધાસીયા
એડવોકેટ

KSHITIJ INVESTMENTS LIMITED					
Regd. Office : 509, Loha Bhavan, 93 P.D. Mello Road, Carnac Bunder, Mumbai - 400 009					
CIN-L67120MH1979PLC021315					
STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2023					
(Rs. in Thousands)					
Sr. No.	Particulars	QUARTER ENDED		YEAR ENDED	
		30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2022
		Unaudited	Audited	Unaudited	Audited
1	(a)Revenue from Operations	-	-	-	-
	(b)Other Income	-	1,920.00	-	1,920.00
	Total Income (1)	-	1,920.00	-	1,920.00
2	Expenses				
	(a) Consumption of Raw Materials	-	-	-	-
	(b) Finished Goods Purchased	-	-	-	-
	(c) Changes in inventories of Finished goods, Work-in- progress & Stock-in-trade	-	-	-	-
	(c) Employee Benefit Expense	20.00	30.00	60.00	200.00
	(d) Finance Cost -	-	-	-	-
	(e) Depreciation & Amortisation Expenses	-	-	-	-
	(f) Other Expenses	717.13	93.87	439.56	865.84
	Total Expenses (2)	737.13	123.87	499.56	1065.84
3	Profit/Loss before Exceptional Items & Tax (1-2)	-737.13	1796.13	-499.56	854.16
4	Exceptional Items -	-	-	-	-
5	Profit/Loss from ordinary activities before Tax (3-4)	-737.13	1796.13	-499.56	854.16
6	Tax Expense - Current Tax	-	-	-	-
	- Deferred Tax	-	-	-	-
	Total Tax Expense (6)	-	-	-	-
7	Profit/Loss from ordinary activities after Tax (5-6)	-737.13	1796.13	-499.56	854.16
8	Other Comprehensive Income				
	(a) Items that will not be reclassified to profit or loss	-	-	-	-
	(b) Items that will be reclassified to profit or loss	-	-	-	-
9	Total Comprehensive Income (Net of tax)	-737.13	1796.13	-499.56	854.16
10	Paid-up Equity share capital (F.V of ₹ 10/- per share)	6294.00	6294.00	6294.00	6294.00
11	Reserves (Excluding Revaluation reserve)	-	-	-1245.42	-2099.58
12	Earnings Per share (₹)				
	- Basic	-1.171	2.854	-0.794	1.357
	- Diluted	-1.171	2.854	-0.794	1.357

Notes:

1) The above results have been reviewed by the Audit committee and approved by the Board of Directors at their respective meetings held on 04.08.2023

2) The Auditors have carried out "Limited Review" of the Financial Results for the 3 months ended on 30.06.2023 in terms of Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

3) There is no separate segment as per AS 17 as most of the operation is related to single segment

4) There was no investor complaint received during the quarter

5) Figures have been regrouped and re-arranged where necessary to make them comparable.

6) Reconciliation of standalone Financial Results as previously reported (referred to as "GAAP"- Generally accepted accounting standards) and Ind AS are summarised as below:

(Rs. In thousands)

Particulars	Quarter ended 30.06.2022
Net Profit/ Loss as per previously reported "GAAP" (after tax)	-499.56
Effect of transition to Ind AS	
NIL	
Net profit/loss for the period as reported under Ind AS	-499.56
Other comprehensive Income (Net of Tax)	
Total Comprehensive Income for the period (Net of Tax)	-499.56

For KSHITIJ INVESTMENTS LIMITED

PRANAV VINAYAKUMAR RAJAKUMAR


DIRECTOR

DIN:- 00289342

Place : Mumbai

DATE : 04.08.2023

FILATEX INDIA LIMITED					
Regd. Office : S.No.274, Demni Road, Dadra-396 193 (UT of Dadra & Nagar Haveli)					
Corporate Identification Number (CIN)- L17119DN1990PLC000091					
Extract of Statement of Unaudited Financial Results for the Quarter ended June 30, 2023					
S. No.	PARTICULARS	Quarter Ended		Year Ended	
		30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2023
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
1	Total income from operations	1,06,927	1,04,678	1,02,329	4,30,387
2	Net Profit/ (loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	2,396	2,527	5,848	12,208
3	Net Profit/(Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	2,396	2,527	5,848	12,208
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	1,762	1,861	4,339	8,990
5	Total Comprehensive Income for the period [Comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	1,769	1,910	4,331	9,014
6	Paid up Equity Share Capital (Face value of Rs. 1/- each)	4,439	4,430	4,430	4,430
7	Earnings Per Share (Face value of Rs. 1/- each) (Not Annualised)				
	Basic :	0.40	0.42	1.94	2.02
	Diluted :	0.40	0.42	1.93	2.02
Notes:					
a) The above is an extract of the detailed format of results for Quarter ended June 30, 2023 filed with the stock exchanges under regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Yearly financial results are available on Company's Website www.filatex.com and on the website of the Stock Exchanges www.nseindia.com and www.bseindia.com.					
b) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on August 04, 2023 and have undergone "Limited Review" by the Statutory Auditor's of the Company. The financial results have been prepared in accordance with Indian Accounting Standards (IND-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and relevant amendment rules thereafter.					
On behalf of the Board of Directors					
Sd/-					
MADHU SUDHAN BHAGERIA					
CHAIRMAN & MANAGING DIRECTOR					
DIN : 00021934					
Place : New Delhi					
Dated : August 04, 2023					


TCPL
 packaging limited

CIN:-L22210MH1987PLC044505

Regd.Office:- Empire Mills Complex, 414, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400 013

Tele:- 022-61646000 | Website:- www.tcpl.in | Email:info@tcpl.in

**STATEMENT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED
FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023**

(₹ in lakhs except EPS)

Particulars	Standalone			
	Quarter ended		Year ended	
	30-Jun-23	31-Mar-23	30-Jun-22	31-Mar-23
	Unaudited	Audited	Unaudited	Audited
Total Revenue	36108.78	38170.59	33891.10	144183.66
Net Profit before exceptional items and tax	3382.75	3858.25	3184.55	14108.50
Net Profit for the period before tax (after exceptional items)	3382.75	3858.25	3184.55	15836.23
Net Profit for the period after tax	2519.75	2756.10	2257.55	11754.08
Total Comprehensive Income for the period (after tax)	2507.75	2754.93	2238.88	11727.51
Equity Share Capital	910.00	910.00	910.00	910.00
Reserves (excluding Revaluation Reserves as shown in Balance Sheet of previous year)				44333.48
Earnings Per Share (of ₹ 10/- each) : Basic and diluted (₹)	27.69	30.29	24.81	129.17
Particulars	Consolidated			
	Quarter ended		Year ended	
	30-Jun-23	31-Mar-23	30-Jun-22	31-Mar-23
	Unaudited	Audited	Unaudited	Audited
Total Revenue	37188.31	39455.15	34601.33	148450.11
Net Profit before exceptional items and tax	3210.98	3572.46	3175.94	13430.74
Net Profit for the period before tax (after exceptional items)	3210.98	3572.46	3175.94	15158.47
Net Profit for the period after tax	2359.84	2415.12	2250.56	11044.01
Total Comprehensive Income for the period (after tax)	2347.42	2413.59	2233.66	11023.49
Equity Share Capital	910.00	910.00	910.00	910.00
Reserves (excluding Revaluation Reserves as shown in Balance Sheet of previous year)				43265.82
Earnings Per Share (of ₹ 10/- each) : Basic and diluted (₹)	26.13	26.54	24.73	121.36

Notes:

- 1- The above unaudited quarterly financial results of the Company have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its meeting held on August 04, 2023. Limited Review as required under regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015 has been carried out by auditors of the Company who have issued an unmodified Limited Review report on these results.
- 2- The Company has subscribed to 58,786 shares on right basis in its subsidiary company Creative Offset Printers Pvt Ltd ("COPL") during the quarter ended June 30, 2023. Post allotment the Company's holding in COPL has increased to 88.66 %.
- 3- The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange websites www.bseindia.com and www.nseindia.com and also on our Company's website www.tcpl.in

For & on behalf of the Board of Directors

Saket Kanoria

Managing Director

DIN:- 00040801


Place : Mumbai

Date : 04.08.2023

S. E. RAILWAY – TENDER
E-Tender Notice No. : 31-EL-WT-2023-24. Sr. Divisional Electrical Engineer (G). Chakradharpur acting for & On behalf of The President of India invites e-Tenders against open tender. Manual offers are not allowed against this tender, and any such manual offer received shall be ignored. Name of work : Comprehensive Annual Maintenance Contract for maintenance of Roof Mounted AC package units with control panel in Roof Mounted AC package unit type Self Generating AC coaches at the coaching maintenance depots at Tatanagar & Rourkela in Chakradharpur Division for 3 years. Tender Value : ₹ 2,41,26,580.94. EMD : ₹ 2,70,600/- Tender Document Cost : ₹ Nil. Date of Closing/ Opening : 31.08.2023, 15:00 hrs. The tender can be viewed at website <http://www.ireps.gov.in> The tender/bidders must have Class-III Digital Signature Certificate & must be registered under IREPS Portal. Only registered tenderer/bidder can participate on e-tendering. All relevant paper must be uploaded at the time of participating in e-tendering. (PR-470)

PUBLIC NOTICE
Notice is hereby given that the Share Certificate Nos 85735 for 400 Ordinary Shares of FV Rs. 5, Folio No GNA0090065, bearing Distinctive Numbers 55865606-55866005 of Grindwell Norton Ltd of 5th Level, Leela Business Park, Andheri-Kurla Road, Andheri (East), Mumbai 400 059, standing in the name of Madipalli Annapurna Devi have been reported lost and that an application for issue of Duplicate Certificates in respect thereof has been made to the Company's RTA, TSR Consultants Pvt Ltd, C-101, 247 Park, LBS Marg, Mumbai-400083. To whom, objection, if any, against issuance of such Duplicate Share Certificates should be made within 15 days from the publication of this notice. The public are cautioned against dealing in any manner with these shares.

CLASSIFIED CENTRES IN MUMBAI
Sanjeev Communication
Fort. Phone : 40024682/ 40792205.
S. Arts, Advtg. Masjid. Phone : 23415111
Taj Publicity Services, Byculla (W). Phone : 2305 4894. Mobile : 9892011371.
Yugambha Advertising, Girgaon. Phone : 2386 8065. Mobile : 9869074144.
Aaryan Publicity Dadar (E). Phone : 022-65881876 Mobile : 9320111876
B. Y. Padhye Publicity Services, Dadar (W). Phone : 2422 9241/ 2422 0445.
DATEY Advertising, Dahanu, Dadar (W). Mobile : 9452049979/ 992049817
Hook Advertisement Dadar. Mobile : 8691800888
Central Advertising Agency, Mahim (W). Phone : 24468656 / 24465555
Charadatta Advertising, Dadar (W). Phone : 24221461
Jay Publicity, Dadar (E). Phone : 24124640
Pallavi Advtg. Dadar (W). Mobile : 9869109765
Shree Swami Samarth Advertising, Dadar (W). Phone : 24440631 Mobile : 9869131962
Stylus Arts, Dadar (W). Phone : 24304897
Time Advertising, Matunga (W). Phone : 2446 6191
Vijaya Agencies, Dadar (W). Phone : 2422 5672. Mobile : 9920640689
Media Junction, Matunga (W). Phone : 022-66393184/ 022-66332340 Mobile : 9820295353/ 9821656198
Achievers Media Bandra (W). Phone : 22691584

पंजाब नैशनल बैंक  **punjab national bank**
...उपरे का जर्जिया / ...the name you can BANK upon /
SHARE DEPARTMENT, BOARD & CO-ORDINATION DIVISION
Plot No. 4, Dwarka Sector-10, New Delhi-110075
Email Id: hsd@pnb.co.in, Tel # 011-28044857
PUBLIC NOTICE
Notice is hereby given that Share Certificate of the Bank mentioned below has been reported lost/misplaced/stolen and the registered holder thereof / claimant thereto has requested for issue of duplicate share certificate:

Sr. No.	Name of Shareholder	Folio No.	Share Certificate No.	Distinctive No. of Shares	No. of Shares
1.	Rajnish Chand Jain	1243816	027065	6739636446-6739636560	115

In case any person has any claim in respect of the said shares/any objection(s) for the issuance of duplicate certificate in favour of the above stated shareholder/ claimant, he/she/they should lodge their claim or objection within 15 days of the date of publication of this Notice. If within 15 days from the date hereof no claim is received by the Bank in respect of the said certificate, duplicate share certificate/letter of confirmation will be issued. The public is hereby cautioned against dealing in any way with the above mentioned certificate(s).
For Punjab National Bank (Ekta Pasricha) Company Secretary
Date: 04.08.2023
Place: New Delhi

zomato
Zomato Limited
CIN: L93030DL2010PLC198141
Registered Office: Ground Floor 12A, 94 Meghdoot, Nehru Place, New Delhi – 110019, India
Website: www.zomato.com; E-mail: companysecretary@zomato.com
Phone No : +91 11 40592373
INFORMATION REGARDING 13TH ANNUAL GENERAL MEETING ("AGM") OF ZOMATO LIMITED TO BE HELD THROUGH VIDEO CONFERENCING ("VC") / OTHER AUDIO VISUAL MEANS ("OAVM")

Members may please note that the 13th AGM of the Company will be held through VC/ OAVM on Wednesday, August 30, 2023 at 4:30 PM (IST), in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the rules made thereunder ("Act") read with General Circular Nos. 14/2020 dated April 08, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 05, 2020, 02/2021 dated January 13, 2021, 02/2022 dated May 5, 2022, 10/2022 dated December 28, 2022 and other relevant circulars issued in this regard by the Ministry of Corporate Affairs, read with SEBI Circulars Nos. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, SEBI/HO/CFD/PoD-2/P/ CIR/2023/4 dated January 5, 2023 and other applicable circulars issued in this regard by Securities and Exchange Board of India ("SEBI") (collectively referred to as "Circulars"), the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, to transact the business(es) as set out in the Notice of the AGM. Members attending the meeting through VC/ OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.

In compliance with the above Circulars, copies of the Notice of the AGM along with the Annual Report for the financial year ended on March 31, 2023 will be sent to the members, whose names appear in the register of members as on Thursday, August 3, 2023 and whose email addresses are available/ registered with the Company/ depositories/ depository participants ("DP"). The same will also be available on Company's website www.zomato.com, website of the stock exchanges i.e. BSE Limited and National Stock Exchange of India at www.bseindia.com and www.nseindia.com respectively, and also at the website of e-voting agency i.e. Link Intime India Private Limited, Registrar and Share Transfer Agent of the Company ("RTA") at www.linkintime.co.in. Any member requiring the hard copy of Notice of the AGM and Annual Report may write to RTA at visual.digit@linkintime.co.in or the Company at companysecretary@zomato.com.

Members of the Company holding equity shares in physical/ dematerialized form and who have not registered their email address can register their email address to receive Notice and Annual Report by following the process given below:

- Click on https://web.linkintime.co.in/EmailReg/Email_Register.html
- The members are requested to select the Company and provide details such as Name, Folio Number/DP Id Client ID, Certificate number (for physical share) PAN, mobile number and e-mail id and also upload the image of PAN, Aadhar Card, share certificate (for physical shares), client master detail (for demat share) or Form ISR-1 (for physical share) in PDF or JPEG format (upto 1 MB).
- On submission of the requisite shares details, an OTP will be received by the member which needs to be entered in the link for verification. The above email registration process for demat holders will be temporary registration.

In case of any query, a member may send an e-mail to RTA at visual.digit@linkintime.co.in, under help section or call on Tel no.: 022-49186000.

Members who wish to register/ update their email address with the Company may follow below instructions:

Dematerialized Shares	Register/ update the email address by following the process prescribed by the concerned DP.
Physical Shares	Register/update the details in prescribed Form ISR-1 with RTA of the Company, at kyc@linkintime.co.in . Further, members may download the prescribed forms from the Company's website at https://www.zomato.com/investor-relations/resources .

All members holding shares in dematerialized or physical form including the members who have not registered their email address will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the AGM through remote e-voting or through e-voting system at the AGM.